

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
મહાનગર સેવા સંદર્ભ
સરદાર પટેલ ભવન
આસ્ટોડીયા રોડ, અમદાવાદ ૩૮૦૦૦૧



માહિતી(મેળવવાના) અધિકાર અધિનિયમ, ૨૦૦૫
પ્રો-એક્ટીવ ડિસ્કલોઝર
(સને ૨૦૨૩)

ઇન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતુ
ફોન નં. ૨૫૭૯૯૯૯
અંક. ૫૪૬, ૫૮૮, ૪૧૮, ૬૮૪, ૮૯૦

એનેક્ષર-એ

(સામાન્ય વહીવટ વિભાગના તા. ૧.૫.૦૮ ના પરિપત્ર ક્રમાંક:- પીએડી-૧૦-૨૦૦૭-૩૩૫૩૬૪- આરટીઆઈ સેલનું બિડાણ)

પ્રમાણપત્ર

આથી પ્રમાણિત કરવામાં આવે છે કે, મારી વરી કચેરી(પ્રોપર) તથા મારા વહીવટી કાર્યક્રમના આ સાથેની યાદી મુજબના જાહેર સત્તામંડળો દ્વારા માહિતી અધિકાર અધિનિયમની કલમ: ૪ અંતર્ગત સ્વયં જાહેર કરવાની બાબતો(પ્રોએક્ટિવ ડીસ્ક્લોઝર) (P.A.D.) તૈયાર કરવામાં આવી છે તા.૦૧.૦૫.૨૦૨૩ ની સ્થિતિએ અધતન કરવામાં આવેલ છે, જેનું અમારા દ્વારા માણે મે- ૨૦૨૩ દરમ્યાન ઈન્સપેક્શન-કમ-ઓડીટ કરવામાં આવ્યું છે અને જે બાબતે ક્ષતિ જણાઈ હતી અગર તો અપૂરતી વિગતો જણાઈ હતી તેની પૂર્તતા કરાવવામાં આવી છે.

૨. તા. ૧.૫.૨૦૨૩ ની સ્થિતિએ હવે કોઈ જાહેર સત્તામંડળોના પ્રોએક્ટિવ ડીસ્ક્લોઝર (P.A.D.) નું ઈન્સપેક્શન- કમ-ઓડીટ બાકી રહેલ નથી.

તા. ૦૧/૦૫/૨૦૨૩

જાહેર માહિતી અધિકારી
વેલ્ક્ષર કમ લેબર ઓફિસર(આઈ.આર.)

એનેક્ષર-બી

(સામાન્ય વહીવટ વિભાગના તા.૦૧.૦૭.૨૦૧૧ ના પરિપત્ર ક્રમાંક:- પીએડી-૧૦-૨૦૦૭-૩૩૫૩૬૪- આરટીઆઈ સેલનું બિડાણ)

આથી પ્રમાણિત કરવામાં આવે છે કે, માહિતી અધિકાર અધિનિયમની કલમ: ૪ અંતર્ગત સ્વયં જાહેર કરવાની બાબતો પ્રોએક્ટિવ ડીસ્ક્લોઝર (P.A.D.) મારા વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ છે અને તા. ૧.૦૫.૨૦૨૩ ની સ્થિતિએ અમારી મંજૂરી મેળવી અધતન કરવામાં આવેલ છે.

તા. ૦૧/૦૫/૨૦૨૩

મુખ્ય મથક:- અમદાવાદ મ્યુ.કોર્પોરેશન
સરદાર પટેલ ભવન, અમદાવાદ

લેબર ઓફિસર
ઇન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતુ

પ્રમાણપત્ર

આશી પ્રમાણિત કરવામાં આવે છે કે, તા. ૧.૦૫.૨૩ થી તા. ૩૦.૪.૨૦૨૪ દરમ્યાન મારા વહીવટી કાર્યક્ષેત્ર હેઠળની આ સાથેની યાદી મુજબના જાહેર સત્તામંડળો દ્વારા માહિતી અધિકાર અધિનિયમની કલમ: ૪ અંતર્ગત સ્વયં જાહેર કરવાની બાબતો “પ્રોએક્ટીવ ડિસ્કલોઝર” (PAD) તૈયાર કરવામાં આવી છે. તેનું અમારા દ્વારા ઇન્સ્પેક્શન-કમ-ઓડીટ કરવામાં આવ્યું છે અને જે બાબતે ક્ષતિ જણાઈ હતી અગર તો અપૂરતી વિગતો જણાઈ હતી તેની પૂર્તા કરાવવામાં આવી છે.

૨. તા. ૦૧-૦૫-૨૦૨૩ ની સ્થિતિએ આ સાથેની યાદી મુજબના જાહેર સત્તામંડળોના “પ્રોએક્ટીવ ડિસ્કલોઝર” (PAD) નું ઇન્સ્પેક્શન-કમ-ઓડીટ પૂર્ણ થઈ ગયેલ છે. તેનું પ્રમાણપત્ર મોકલી આપવામાં આવશે.

લેબર ઓફિસર
ઇન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતુ

તા. ૦૧/૦૫/૨૦૨૩
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન

અનુકમણિકા

અનુકમ	વિષય
૧	ઇન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાનું વહીવટી માળખુ અને કામગીરી
૨	ઇન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાના અધિકારી/ કર્મચારીઓની ફરજો તથા સત્તાઓ
૩	ઇન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાના સ્ટાફની રીરેકટરી
૪	ઇન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાના અધિકારી/ કર્મચારીઓના માસિક મહેનતાણા/ ભથ્થાંની વિગત
૫	સફાઈ કામદારોના વારસદારોને રહેમરાહે નોકરી આપવાના નિયમો બાબત
૬	ઇન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતામાં નિર્ણય લેવામાં અનુસરવામાં આવતી પદ્ધતિ
૭	પેન્ડિંગ ખાતાકીય તપાસની વિગતો
૮	ઇન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાનું મંજૂર થયેલ બજેટ
૯	ઇન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાના એપેલેટ ઓથોરીટી, તથા જાહેર માહિતી અધિકારીની વિગત

ઇન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાનું વહીવટી માળખુ અને કામગીરી

(૧) વહીવટી માળખુ

- (એ) કચેરીનું સ્થળ :- અમદાવાદ મહાનગર સેવા સંદર્ભ
સરદાર પટેલ ભવન, પ્રથમ માળે, “સી” બ્લોક
સેન્ટ્રલ ઓફિસની બાજુમાં, દાણાપીઠ, અમદાવાદ ત૮૦ ૦૦૧
- (બી) કચેરીનો સમય :- સવારના ૧૦:૩૦ થી ૬:૧૦ સુધી
(૨:૦૦ થી ૨:૩૦ રીસેસ)
- (સી) ખાતાના વિભાગો:- મુખ્ય ચાર વિભાગમાં કામ કરે છે.
(૧) ખાતાનું એસ્ટાબ્લીશમેન્ટ
(૨) લેબર સેલ(લેબર કોર્ટ/ઇન્ડસ્ટ્રીયલ ટ્રીબ્યુનલની કામગીરી)
(૩) ખાતાકીય તપાસ
(૪) સફાઈ કામદારોના આંશિતોને નોકરી

વહીવટી માળખુ

ડ.મ્યુનિ.કમિશનર(ઇન્ડસ્ટ્રીયલ રીલેશન)

લેબર ઓફિસર

આસી.મેનેજર

ખાતાકીય તપાસ અધિકારી	એસ્ટાબ્લીશમેન્ટ કલાર્ક	સ્ટેનો ગ્રાફર	વેલકર કમ લેબર ઓફિસર	કો.ઓર્ડિનેશન ઓફિસર
૧ શ્રી રમણસિંહ બો.બારીયા	(સીની.કલાર્ક)	ટાઇપીસ્ટ	ડબલ્યુએલઓ (આંશિતને નોકરી)	શી.ની.કલાર્ક
૨ શ્રી મુકેશભાઈ જે. શાહ			ડબલ્યુએલઓ (લેબર કોર્ટ/ઇન્ડસ્ટ્રીયલ ટ્રીબ્યુનલ)	જુ.કલાર્ક
૩ શ્રી પ્રવિષ્ણુભાઈવી. પટેલ			ડબલ્યુએલઓ (મજૂરકમિ.નીકચેરીઅને આંશિતને નોકરી)	પટાવાળા
૪ શ્રી અનિલ એમ.સોની				
૫ શ્રી અદ્રેત એસ. મહેતા				
૬ શ્રી જશવંત કે.પરીખ				

ઇન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાની મુખ્ય કામગીરી

- (૧) ભૂનિ.કોપોરેશનના તમામ ખાતાઓને મજૂર પ્રશ્રોમાં માર્ગદર્શન, સલાહ તથા અભિપ્રાયો આપવા.
- (૨) ઇન્ડસ્ટ્રીયલ ટ્રીબ્યુનલ, લેબર કોર્ટ તથા લેબર કાયદાઓ નીચે રચાયેલ જુદી જુદી ઓથોરીટીઓ સમક્ષ દાખલ થયેલા કેસોનું સંકલન, ભૂનિ.કોપોરેશન તરફથી બચાવ કરવો, એડવોકેટોને માહિતી આપી જવાબો ફાઈલ કરવવા.
- (૩) ઇન્ડસ્ટ્રીયલ ટ્રીબ્યુનલ તથા લેબર કોર્ટના એવોડનો અમલ કરવવા અથવા અપીલ કરવાની કામગીરી.
- (૪) મજૂર કમિશનરશીની કચેરીમાં ચાલતી કન્સીલીએશન કાર્યવાહીમાં રજુઆત કરવી, કન્ટ્રોલીંગ ઓથોરીટી તથા એપેલેટ ઓથોરીટી સમક્ષના ગ્રેજ્યુટીના કેસોની કામગીરી.
- (૫) યુનીયનોના પત્રો તથા રજુઆતો સ્વીકારવી અને સક્ષમ સત્તા પાસે નિર્ણય કરવવો તથા યુનીયનોના હોદ્દેદારો તથા ઓથોરીટીઓ સાથે મીટિંગનું આયોજન.
- (૬) સો.વે.મે. (કોન્જરવન્સી, રેફ્યુઝ તથા ખાળકુવા) ખાતાના કામદારોના મરણ તથા નોકરી દરમ્યાન (મેડીકલ તપાસમાં) અનજીટ થવાના પ્રસંગે તેમના વારસદારોને રહેમરાહે નોકરી આપવાની કામગીરી.
- (૭) ભૂનિ.કર્મચારીઓ તથા અધિકારીઓ વિલઘની ખાતાકીય તપાસની કામગીરી ચાર્જશીટ, શો કોઝ નોટિસ, શિક્ષાના હુકમોના ડ્રાફ્ટીંગ, શિક્ષાના હુકમો ઈસ્યુ કરવા તથા અમલ કરવવાની કામગીરી.
- (૮) જી.પી.એમ.સી. એક્ટ, ૧૯૪૮ ની કલમ: પદ (૪) નીચે કર્મચારીઓએ સ્ટે.કમિટીને કરેલ અપીલની કાર્યવાહી તથા અપીલમાં સ્ટે.કમિટીએ કરેલ ઠરાવના અમલ.
- (૯) સર્વીસ મેટરમાં આવેલ હાઈકોર્ટ, સીટી સીવીલ કોર્ટ, તથા અન્ય કોર્ટના ચુકાદાઓના અમલીકરણ તથા અપીલની કામગીરી.

સને -૨૦૨૩ ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાના અધિકારી/ કર્મચારીની ફરજો તથા સત્તાઓ

અ. નં.	અધિકારી/ કર્મચારીનું નામ	હોદ્દો	સત્તાઓ			ફરજો/ કામગીરીની ટૂંકી વિગત
			વહીવટી	નાણાંકીય	અન્ય	
૧	ડૉ. નરેન જી. હજરી	લેબર ઓફિસર	ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાની તમામ વહીવટી સત્તાઓ	રૂ. ૧૦૦૦/-	-	૧) ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાની વહીવટી દેખરેખ, નિયંત્રણ તથા સુપરવીઝન ૨) તમામ ખાતાઓને મજૂર પ્રશ્નોમાં સલાહ તથા માર્ગદર્શન આપવું. ૩) ગુજરાત હાઇકોર્ટ, સુપ્રીમકોર્ટ ની સર્વાસ મેટરોની કામગીરી. ૪) લેબર તથા ઈન્ડસ્ટ્રીયલ રીલેશન કામગીરી ઉપર દેખરેખ તથા સંકલન, સુપરવીઝન ૫) સફાઈ કામદારોના વારસદારોને રહેમરાહે નોકરી આપવાની કાર્યવાહી ૬) મજૂર પ્રશ્નોમાં વહીવટી અને નીતિ-વિષયક નિર્ણય લેવડાવવા.
૨	શ્રી જ્યંત એસ. ગાઉંડર (મધ્ય ઝોન- વહીવટી ખાતે ફાળવણી)	આસી. મેનેજર	હાથ નીચેના સ્ટાફનું સુપરવિઝન અને દેખરેખ	-	-	૧) તમામ ખાતાના કર્મચારીઓના સસ્પેન્શનના હુકમની કાર્યવાહી ૨) તમામ ખાતાના કર્મચારીઓની શોકોઝ નોટીસ, ચાર્જશીટ, ફાઈનલ શોકોઝ નોટીસ તથા શિક્ષાના હુકમો સંબંધીત કાર્યવાહી ૩) હાઇકોર્ટ એડવોકેટ સાથે સંકલનની કામગીરી ૪) રાજ્ય સરકાર સાથે થતા પત્ર વ્યવહાર અંગેની કાર્યવાહીની કામગીરી ૫) તમામ ડે.ભૂનિ.કમિશનરશીઓ સાથે કર્મચારીઓની સુનાવણી અંગેની કામગીરી તથા તેને આનુષ્ઠાનિક કાર્યવાહી
૩	શ્રી અમરીષ ડી. જાની	વેલ્ફર કમ લેબર ઓફિસર		-	-	૧) લેબર કમિશનરની કચેરીમાં ચાલતા કન્સિલીએશનના કેસોની કામગીરી ૨) કંટ્રોલોંગ ઓથોરીટી, એપેલેટ ઓથોરીટી તથા મજૂર કાયદાઓ નીચે નિમાયેલ અન્ય ઓથોરીટીઓના કેસોની કામગીરી ખાતા તથા એડવોકેટ સાથે સંકલનમાં રહીને કરવી. ૩) ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમઝોનના સો. વે. મે. ખાતાના સફાઈ કામદારોના મરણ અને અનફીટ થવાના પ્રસંગે આશ્રિતોને નોકરી આપવાની કામગીરી ખાતા તથા એડવોકેટ સાથે સંકલનમાં રહીને કરવી. ૪) તમામ ખાતાના ઈન્ડસ્ટ્રીયલ ટ્રીબ્યુનલમાં ચાલતા કેસોની કામગીરી ખાતા તથા એડવોકેટ સાથે સંકલનમાં રહીને કરવી. ૫) હાઇકોર્ટ એડવોકેટ સાથે ઈન્ડસ્ટ્રીયલ ટ્રીબ્યુનલ ના અપીલ કેસમાં સંકલનની કામગીરી ૬) સીટી સીવીલ કોર્ટમાં આઈ.આર.ખાતાને લગતાં કેસોની કામગીરી ૭) આર.ડી.આઈ. કાયદા અન્યથે જાહેર માહિતી અધિકારી તરીકે કાર્યવાહી કરવી.

૪	શ્રી લક્ષ્મણભાઈ વી. ખાટા	વેલ્ફેર કમ લેબર ઓફિસર		-	-	૧) દક્ષિણાઝોન સો.વે.મે. ખાતાના સફાઈ કામદારોના મરણ અને અનફીટ થવાના પ્રસંગે આશ્રિતોને નોકરી આપવાની કામગીરી ૨) તમામ ખાતાના લેબર કોર્ટમાં ચાલતા કેસોની કામગીરી ખાતા તથા એડવોકેટ સાથે સંકલનમાં રહીને કરવી. ૩) હાઇકોર્ટ એડવોકેટ સાથે લેબર કોર્ટ ના અપીલ કેસમાં સંકલનની કામગીરી ૪) તમામ ખાતાના કર્મચારીઓના સસ્પેન્શનના હુકમની કાર્યવાહી
૫	શ્રી ચંદ્રકાંત દિલીપકુમાર ચૌધરી	વેલ્ફેર કમ લેબર ઓફિસર				૧) યુનિયનના પશ્ચો તથા સક્ષમ સત્તાઓ સમક્ષ યોજવામાં આવતી મીટિંગોની કામગીરી તથા જુદા જુદા આયોગ ની મીટિંગ વખતે સંકલનની કામગીરી ૨) પૂર્વઝોન અને ઉત્તરઝોનના સો.વે.મે. ખાતાના સફાઈ કામદારોના મરણ અને અનફીટ થવાના પ્રસંગે આશ્રિતોને નોકરી આપવાની કામગીરી ૩) મ્યુનિ.કર્મચારી સામે દાખલ થતા તથા દાખલ કરવામાં આવતાં પોલીસ કેસ તથા એ.સી.બી.કેસોની કામગીરી ૪) રક્ષિત કામદારો જાહેર કરવાને લગતી કાર્યવાહી ૫) સરકારી પત્રોને લગતી તમામ કાર્યવાહી ૬) હાઇકોર્ટના કેસ સંબંધિત સંકલનની કામગીરી કરવી.
૬	શ્રી બાલામુરુગન રંગનાથન મુદ્દીયાર	વેલ્ફેર કમ લેબર ઓફિસર				૧) પશ્ચિમઝોન, તથા મધ્યઝોન સો.વે.મે. ખાતાના સફાઈ કામદારોના મરણ અને અનફીટ થવાના પ્રસંગે આશ્રિતોને નોકરી આપવાની કામગીરી ૨) બી.પી.એમ.સી.એક્ટની કલમ-પદ(૪) નીચે થતી અપીલને લગતી કાર્યવાહી કરવી તથા વર્ષવાર પદ(૪) અંગેની અરજી, અરજદારની વિગત, કમીટીનું સ્ટેટ્સ, હાજર કર્યા બાબતની નોંધ, તે અંગેનું પત્રક તૈયાર કરવું. ૩) હાઇકોર્ટના કેસ સંબંધિત સંકલનની કામગીરી કરવી.
૭	શ્રી શંકરલાલ ડી. બરંડા	સંકલન અધિકારી	ખાતાકીય તપાસ કચેરીના સ્ટાફનું સુપરવીઝન અને કામગીરી ઉપર દેખરેખ	-	-	૧) તમામ ખાતાના કર્મચારીઓની શોકોઝ નોટિસ, ચાર્જશીટ, ફાઈનલ શોકોઝ નોટિસ તથા હુકમો સંબંધીત કાર્યવાહી (બજારણી, કર્મચારીઓએ આપેલ જવાબ બાદની કાર્યવાહી) ૨) તમામ ડે.મ્યુનિ.કમિશનરશીઓ સાથે કર્મચારીઓની સુનાવણી અંગેની કામગીરી તથા તેને આનુષ્ઠાંગિક કાર્યવાહી
૮	શ્રી મંગેશ આર.તાવડે	સીની.કલાર્ક		-	-	૧) સેન્ટ્રલ ઓફિસ તથા વિજ્ઞલન્સ ખાતા દ્વારા હાથ ધરવામાં આવતા સરપ્રાઇઝ ચેકોંગમાં ગેરહાજર માલુમ પડતા કર્મચારીઓને શોકોઝ નોટિસો તૈયાર કરવી, એમુંવ કરાવવી તથા ઈસ્યુ કરવા ૨) તે અંગેના શિક્ષાના હુકમો તૈયાર કરવા અને ઈસ્યુ કરવા

						૩) પ્રમોશન તથા કાયમ કરવા સમયે કર્મચારીઓને ખાતાકીય તપાસનું એન.ઓ.સી. આપવું.
૮	શ્રી કમલેશ અચ. પુરોહિત	સીની.કલાર્ક		-	-	૧) રાઈટ ટુ ઈન્ડોર્મેશન નીચેની અરજની કામગીરી. ૨) આવશ્યક સેવાના જહેરનામા તથા આઈ.આર. ખાતાને લગતી તમામ મેટરોમાં રાજ્ય સરકાર સાથે, એ.સી.બી. ઓફિસ, શ્રમ ભુવન, પોલીસ સ્ટેશનો, યુનિવર્સિટી તથા સચિવાલયમાં લાયેજનીંગની તમામ કામગીરી.
૧૦	શ્રી આનંદકુમાર બાબુભાઈ પટેલ	જુની.કલાર્ક		-	-	૧) ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાના એસ્ટાબ્લીસમેન્ટની કામગીરી ૨) ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાના સ્ટાફના પગાર તથા સર્વીસ બુકની જગતવણી ૩) લેબર કોર્ટ, ઈન્ડસ્ટ્રીયલ ટ્રીબ્યુનલ કેસોના રજીસ્ટરોની જગતવણી તથા મેઇન્ટેનાન્સ ૪) ખાતાના અન્ય પરચુરણ બીલોની કામગીરી ૫) આઈ.આર. ખાતાની કન્ટીજન્સીને લગતી તમામ કાર્યવાહી કરવી.
૧૧	શ્રી કિરણબેન એ.ભંડ	ટાઈપોસ્ટ કમ કલાર્ક		-	-	૧) ખાતાકીય તપાસના ચાર્જશીટ, શો. કોર્ઝ નોટિસ, સસ્પેન્શન હુકમ, શિક્ષાના હુકમોના ડ્રાફ્ટ કોમ્યુટર ઉપર ટાઈપ કરવા.- ઈન્કવાયરી ઓફિસરોના રીપોર્ટ ટાઈપ કરવા. ૨) ખાતાની અન્ય ટાઈપોસ્ટ કામગીરી
૧૨	શ્રી ભરતકુમાર રાયમલભાઈ દેસાઈ	સીની.કલાર્ક		-	-	૧) ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાના ઈન્કવાયરી સેલની તમામ ટપાલ લેવી, આઉટવર્ક ઈન્વર્ક કરવી ૨) ઈન્કવાયરીને લગતી તેમજ કોર્ટ મેટરને લગતી તમામ ફાઈલોનું ફેરીસ લીસ્ટ બનાવવું.
૧૩	શ્રી સર્હિદાબાનુ એસ.શેખ	સીની.કલાર્ક		-	-	(૧) આઈ.આર. ખાતાની ટપાલો ઈન્વર્ક આઉટવર્ક કરવી. (૨) પોસ્ટેજ રજીસ્ટર મેઇન્ટેઇન કરવું. (૩) પદ(૪) ને લગતી અપીલને લગતી અરજાઓની કાર્યવાહી કરવી.
૧૪	શ્રી પંકજભાઈ એસ.પટેલ	એ.એમ.ટી. એસ.સ્ટાફ		-	-	૧) ઈન્કવાયરી ઓફિસરના રીપોર્ટ ઉપર સક્ષમ સત્તાએ શિક્ષા અંગે જે નિર્જય લિધેલ હોય તેના અનુસંધાનમાં તૈયાર કરેલ શો. કોર્ઝ નોટિસના ડ્રાફ્ટ ટાઈપ કરાવી સક્ષમ સત્તા સમક્ષ મુકવા ૨) એપ્યુવ થયેલ શો. કોર્ઝ નોટિસ જેતે કસુરદાર કર્મચારીને ઈસ્યુ કરવી.
૧૫	શ્રી ભાવેશકુમાર મગનલાલ પટેલ	એ.એમ.ટી. એસ.સ્ટાફ		-	-	ચાર્જશીટ તથા તેના સંબંધિત પુરાવા સક્ષમ સત્તાની સહી કરાવી અને તેની ઝેરોક કરાવવી, નંબર પાડી જે તે કર્મચારીને ઈસ્યુ કરવી તથા ગેરહાજરીની ચાર્જશીટ બનાવવાની કામગીરી કરવી તેમજ તે અંગેના જરૂરી રજીસ્ટર નિભાવવા તથા વખતોવખત તેના કોમ્યુટરચાઈઝ પત્રકો અપટેટ કરાવવા. ઈન્ડસ્ટ્રીયલ ટ્રીબ્યુનલ, લેબર કોર્ટ અને હાઈકોર્ટના કેસો સંબંધીત માસિક પત્રક બનાવી લીગલ ખાતે મોકલવા તથા વેલ્કેર કમ લેબર ઓફિસરશી (કોર્ટ)ની સાથે રહીને કેસ ટુ કેસ કોર્ટવાઈઝ રજીસ્ટર બનાવવા અને નિભાવવાની કામગીરી કરવી.
૧૬	શ્રી અધ્યિનકુમાર એમ. પંડ્યા	ટાઈપોસ્ટ		-	-	૧) ખાતાકીય તપાસમાં આપવામાં આવતા ચાર્જશીટ, સસ્પેન્શન, ફાઈનલ શો. કોર્ઝ નોટિસો, શિક્ષાના હુકમો કોમ્યુટર ઉપર ટાઈપ કરવા. ૨) ઈન્કવાયરી ઓફિસરોના રીપોર્ટ ટાઈપ કરવા.

						૩) ઇન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાનું અન્ય કાગળોનું ટાઈપીંગ
૧૭	શ્રી રમણભાઈ પી. શર્મા	પટાવાળા		-	-	૧) ઇન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાની તમામ બહારના ખાતાઓના ટપાલની કામગીરી
૧૮	શ્રી જસપાલ રતનલાલ રોટ	પટાવાળા	-	-	-	૧) ઇન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાની અંદરના ખાતાઓની ટપાલની કામગીરી
૧૯	શ્રી પોપટભાઈ બી. રાવળ	પટાવાળા	-	-	-	૧) લેબર ઓફિસરની મુખ્ય ઓફિસે પટાવાળાની કામગીરી, તથા બહારના ખાતાઓની ટપાલની કામગીરી.
૨૦	શ્રી અવનિશકુમાર રમેશભાઈ નૈલા	સફાઈ કામદાર	-	-	-	૧) ઇન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાની ઓફિસને લગતી કામગીરી
૨૧	શ્રી સતીષભાઈ કે. કબીરા	સફાઈ કામદાર	-	-	-	૧) ઇન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાની તમામ બહારના ખાતાઓના ટપાલની કામગીરી તથા ઇન્કવાયરી ઓફિસને લગતી તમામ કામગીરી

- શ્રી પંકજભાઈ એસ.પટેલ, શ્રી મંગેશ આર.તાવડે, શ્રી ભરતકુમાર રાયમલભાઈ દેસાઈ, શ્રી ભાવેશકુમાર પટેલ, શ્રી અવનિશકુમાર નૈલા તેમજ શ્રી સતીષભાઈ કબીરા નો નો પગાર આઈ.આર. ખાતેથી નીકળતો નથી.

ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાના સ્ટાફની ડિરેક્ટરી

અ.ન ંંદિની નંબર	એમ્બ્લોઝ નંબર	નામ	હોદ્દો	ફોન નંબર			ફેક્સ	ઈ-મેઇલ
				ક્રેચેરી	મોબાઇલ	ઘર		
૧	૮૩૭૫	ડૉ. નરેન જી. હજારી	લેબર ઓફિસર	૨૫૩૮૯૮૯૯ (અક્ષ. ૫૪૬)	૯૩૨૭૦૩૮૭૭૩	૦૭૯-૨૫૩૮૪૭૪૪		narenhajari@ahmedabadcity.gov.in
૨	૮૬૫૧	શ્રી જયંત એસ. ગાઉંડર (મધ્ય જોન- વહીવટ ખાતે ફાળવણી)	આસી. મેનેજર	૨૫૩૮૯૮૯૯ (અક્ષ. ૫૪૭)	૯૩૭૬૦૧૬૭૬૫	--	--	
૩	૮૩૮૧	શ્રી અમરિધ ડી. જાની	ડબલ્યુ. એલ ઓ	૨૫૩૮૯૮૯૯ (અક્ષ. ૪૧૮)	૯૩૨૮૩૮૫૫૬૫	--	--	
૪	૮૫૨૭	શ્રી લક્ષ્માણ ભાઈ વી. ખાટા	ડબલ્યુ. એલ.ઓ	૨૫૩૮૯૮૯૯ (અક્ષ. ૪૧૮)	૯૩૨૭૦૩૮૮૪૩			
૫	૮૦૦૨૭	શ્રી ચંદ્રકાંત દિલીપકુમાર ચૌથરી	ડબલ્યુ. એલ.ઓ	૨૫૩૮૯૮૯૯ (અક્ષ. ૪૧૮)	૯૩૪૮૮૦૦૧૦૩			
૬	૭૨૬૧૦	શ્રી બાલામુરુગન રંગનાથન મુદ્દલીયાર	ડબલ્યુ. એલ.ઓ	૨૫૩૮૯૮૯૯ (અક્ષ. ૪૧૮)	૭૦૬૬૦૬૮૨૬૨			
૭	૮૫૦૩	શ્રી શંકરલાલ એલ. બરંડા	સંકલન આવિકારી	૨૫૩૮૯૮૯૯ (અક્ષ. ૬૮૪)	--	--	--	
૮	૮૭૮૬	શ્રી મંગેશ આર. તાવડે	સીની. કલાર્ક	૨૫૩૮૯૮૯૯ (અક્ષ. ૬૮૪)				
૯	૮૬૮૭	શ્રી કમલેશભાઈ એચ. પુરોહિત	સીની. કલાર્ક	૨૫૩૮૯૮૯૯ (અક્ષ. ૬૮૪)				
૧૦	૮૮૫૭	શ્રી સર્દારબાનુ એસ. શેખ	સીની. કલાર્ક	૨૫૩૮૯૮૯૯ (અક્ષ. ૬૮૪)				
૧૧	૮૩૦૨	કિરણબેન એ. ભડ્ક	ટાઈપીસ્ટ કમ કલાર્ક	૨૫૩૮૯૮૯૯ (અક્ષ. ૬૮૪)				
૧૨	૪૬૭૭૦	શ્રી ભરતકુમાર આર. દેસાઈ	સીની. કલાર્ક	૨૫૩૮૯૮૯૯ (અક્ષ. ૬૮૪)				
૧૩	૪૬૬૮૮	શ્રી આનંદકુમાર બી. પટેલ	જુની કલાર્ક	૨૫૩૮૯૮૯૯ (અક્ષ. ૬૮૪)				
૧૪	૧૦૫૨૦	શ્રી પંકજભાઈ એસ. પટેલ	એ.એમ. ટી.એસ. સ્ટાફ	૨૫૩૮૯૮૯૯ (અક્ષ. ૬૮૪)				

૧૫	૧૧૪૨૫	શ્રી ભાવેશકુમાર મગનલાલ પટેલ	એ.એમ. ટી.એસ. સ્ટાફ	૨૫૩૮૯૮૯૯ (અક્ષ. ફેબ્રુઆરી)				
૧૬	--	શ્રી અધ્યિનકુમાર એમ. પંડ્યા	ટાઇપીસ્ટ	૨૫૩૮૯૮૯૯ (અક્ષ. ફેબ્રુઆરી)				
૧૭	૩૪૦૫૨	શ્રી રમણભાઈ પી.શર્મા	પટાવાળા	૨૫૩૮૯૮૯૯ (અક્ષ. ફેબ્રુઆરી)				
૧૮	૩૮૧૮૪	શ્રી જસપાલ આર.રોત	પટાવાળા	૨૫૩૮૯૮૯૯ (અક્ષ. ફેબ્રુઆરી)				
૧૯	૩૮૩૩૦	શ્રી પોપટભાઈબી. રાવળ	પટાવાળા	૨૫૩૮૯૮૯૯ (અક્ષ. ફેબ્રુઆરી)				
૨૦	૧૭૬૦	શ્રી અવનિશકુમાર રમેશભાઈ નેલા	સફાઈ કામદાર	૨૫૩૮૯૮૯૯ (અક્ષ. ફેબ્રુઆરી)				
૨૧	૬૦૧૯૭	શ્રી સતીધભાઈ કે. કબીરા	સફાઈ કામદાર	૨૫૩૮૯૮૯૯ (અક્ષ. ફેબ્રુઆરી)				

ઇન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાના અધિકારી/ કર્મચારીઓના માસિક મહેનતાણાનું સ્ટેટમેન્ટ

અ. નં.	એમ્પ્લોઈ નં.	નામ	હોકી	માસિક મહેનતાણાં / પગાર	વળતર ભાષ્યું	નીતિનિયમ મુજબ મહેનતાણાં નક્કી કરવાની પદ્ધતિ
૧.	૮૩૭૫	ડૉ. નરેન જી. હજારી	લેબર ઓફિસર	૬૭૭૦૦-૨૦૮૭૦૦ (બેઝીક પગાર : ૧૦૮૮૦૦)	કોપોરિશન દ્વારા વાહન ફાળવવામાં આવેલ છે.	રાજ્ય સરકારના પગાર પંચ અન્યે પગાર ધોરણનો અમલ કરવામાં આવે છે.
૨.	૫૬૫૧	શ્રી જયંત એસ. ગાઉન્ડર (મધ્ય ઝોન- પ્રોફેશનલ ટેક્સ ખાતે ફાળવણી)	આસી. મેનેજર	૫૩૧૦૦-૧૬૭૮૦૦ (બેઝીક પગાર : ૭૩૪૦૦)	---	*****
૩.	૮૩૮૧	શ્રી અમરીષ ડી. જાની	ડબલ્યુ. એલ. ઓ.	૫૩૧૦૦-૧૬૭૮૦૦ (બેઝીક પગાર : ૮૪૧૦૦)	મોટરસાયકલ એલાઉન્સ	*****
૪.	૮૪૨૭	શ્રી લક્ષ્મણભાઈ વી. ખાટા	ડબલ્યુ. એલ. ઓ.	૫૩૧૦૦-૧૬૭૮૦૦ (બેઝીક પગાર : ૭૪૬૦૦)	મોટરસાયકલ એલાઉન્સ	*****
૫	૫૦૦૨૭	શ્રી ચંદ્રકાંત ટિલીપુરુષ	ડબલ્યુ. એલ. ઓ.	૪૪૮૦૦-૧૪૨૪૦૦ (બેઝીક પગાર : ૫૦૫૦૦)	મોટરસાયકલ એલાઉન્સ	
૬	૭૨૬૧૦	શ્રી બાલામુરુગન રંગનાથન મુદ્દલીયાર	ડબલ્યુ. એલ. ઓ.	૪૪૮૦૦-૧૪૨૪૦૦ (બેઝીક પગાર : ૫૦૫૦૦)	મોટરસાયકલ એલાઉન્સ	
૭	૮૫૦૩	શ્રી શંકરલાલ એલ. બરંડા	સંકલન અધિકારી	૫૩૧૦૦-૧૬૭૮૦૦ (બેઝીક પગાર : ૭૩૪૦૦)	મોટરસાયકલ એલાઉન્સ	*****
૮	૭૨૦૮૭	નાયક બિજેશકુમાર જી. (ફાળવણી અન્ય ખાતે)	સ્ટેનોગ્રાફર-૨	૪૪૮૦૦-૧૪૨૪૦૦ (બેઝીક પગાર : ૮૭૭૦૦)	-	-----
૯	૮૭૮૬	શ્રી મંગેશ આર. તાવડે	સીની. કલાર્ક	૩૪૮૦૦-૧૧૨૪૦૦ (બેઝીક પગાર : ૫૩૬૦૦)	"	*****
૧૦	૮૬૮૭	શ્રી કમલેશ એચ. પુરોહિત	સીની. કલાર્ક	૪૪૮૦૦-૧૪૨૪૦૦ (બેઝીક પગાર : ૫૬૮૦૦)	"	*****
૧૧	૮૮૫૭	શ્રી સર્દારબાનુ એસ. શેખ	સીની. કલાર્ક	૪૪૮૦૦-૧૪૨૪૦૦ (બેઝીક પગાર : ૫૬૮૦૦)	"	*****
૧૨	૫૩૦૨	શ્રી કિરણબેન એ. ભંડ	ટાઇપીસ્ટ કમ કલાર્ક	૨૯૨૦૦-૮૨૩૦૦ (બેઝીક પગાર : ૪૫૪૦૦)	--	*****
૧૩	૪૬૭૭૦	શ્રી ભરતકુમાર રાયમલભાઈ દેસાઈ	સીની. કલાર્ક	૨૫૫૦૦-૮૧૧૦૦ (બેઝીક પગાર : ૩૪૩૦૦)	"	*****
૧૪	૪૬૬૮૮	શ્રી આનંદકુમાર બાબુભાઈ પટેલ	જુની. કલાર્ક	૧૯૯૦૦-૬૩૨૦૦ (બેઝીક પગાર : ૧૯૯૦૦)		

૧૫	૧૦૪૨૦	શ્રી પંકજભાઈ એસ.પટેલ	અ.એમ.ટી.એસ સ્ટાફ	૨૫૫૦૦-૮૯૯૦૦ (બેઝીક પગાર ૪૨૨૦૦)	“	“““““
૧૬	૧૭૬૦	શ્રી ભાવેશકુમાર મગનલાલ પટેલ	અ.એમ.ટી.એસ સ્ટાફ	૧૮૫૦૦-૬૩૨૦૦ (બેઝીક પગાર ૨૮૪૦૦)	“	“““““
૧૭	----	શ્રી અશ્વિનકુમાર એમ. પંડ્યા (કરાર આધારીત નિમણુંક)	ટાઇપિસ્ટ કમ કલાર્ક	ઓચ્ક માસિક વેતન રૂ. ૨૦૦૦૦/-	--	“““““
૧૮	૩૮૩૩૦	શ્રી રાવળ પોપટભાઈ બી.	પટાવણા	(૧૫૭૦૦-૫૦૦૦૦) (બેઝીક પગાર : ૨૦૫૦૦)	“	“““““
૧૯	૩૮૧૮૨	શ્રી જસપાલ આર. રોત	પટાવણા	(૧૫૭૦૦-૫૦૦૦૦) (બેઝીક પગાર : ૨૧૧૦૦)	“	“““““
૨૦	૩૪૦૮૨	શ્રી રમણભાઈ પી. શર્મા	પટાવણા	(૨૧૭૦૦-૬૮૧૦૦) (બેઝીક પગાર : ૩૮૩૦૦	“	“““““
૨૧	૪૪૨૦૨	શ્રી અવનિશકુમાર રમેશભાઈ નૈલા	સફાઈ કામદાર	૧૪૮૦૦/૪૭૧૦૦ (બેઝીક પગાર : ૧૭૨૦૦)	“	“““““
૨૨	૮૦૧૮૭	શ્રી સતીષભાઈ કે.કબીરા	સફાઈ કામદાર	૧૪૮૦૦-૪૭૧૦૦ (બેઝીક પગાર-૧૮૩૦૦)	“	“““““

- શ્રી પંકજભાઈ એસ.પટેલ, શ્રી જ્યોતિબેન એ. પટેલ, શ્રી ભરતકુમાર રાયમલભાઈ ટેસાઈ, શ્રી ભાવેશકુમાર પટેલ, શ્રી અવનિશકુમાર નૈલા તેમજ શ્રી સતીષભાઈ કબીરા નો નો પગાર આઈ.આર. ખાતેથી નીકળતો નથી.

સર્કારી કામદારોના વારસદારોને રહેમરાહે નોકરી આપવા માટેના નિયમો

(૧)	નિયમોનું નામ	સો.વે.મે.ખાતાના સર્કારી કામદારો, રેફયુઝ તથા ખાળકુવા ખાતાના કામદારોને મરણ તથા નોકરી દરમ્યાન અનજીટ થાય તો તેના વારસદારને રહેમરાહે નિમણૂક આપવી
(૨)	દસ્તાવેજનો પ્રકાર	<p>(૧) સ્ટે.કમિટી ઠરાવ નં. ૧૨૮૬, તા. ૧૮.૧.૦૬</p> <p>(૨) ભ્યુ.કો.ઠરાવ નં. ૧૦૮૩, તા. ૧૮.૧.૦૬</p> <p>(૩) રહેમરાહે નોકરી આપવાના નિયમો પરિશિષ્ટ-એ</p> <p>(૪) ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતુ, સરક્યુલર નં. ૧, તા.૨૮.૬.૦૬</p> <p>(૫) ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતુ સરક્યુલર નં. ૧, તા. ૧૧.૬.૦૮</p> <p>(૬) પણ વર્ધનો સરક્યુલર તા. ૧૮.૫.૨૦૧૦</p> <p>(૭) સ્ટે.કમિટી ઠરાવ નં. ૩૫૬, તા. ૨૦.૬.૧૫, ભ્યુ.કો.ઠરાવ નં. ૪૭૫ તા. ૨૮.૭.૧૫ મુજબ, ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતુ, સરક્યુલર નં. ૧, તા.૨૮.૬.૧૫</p> <p>(૮) ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતુ, સરક્યુલર નં. ૧, તા.૨૮.૬.૨૧</p> <p>(૯) સો.વે.મે.વિભાગ સરક્યુલર નં. ૧ તા. ૧૦/૧૧/૨૧</p>
(૩)	વારસદારની નોકરીના નિયમોની નકલ કયાંથી મળી શકશે	લેબર ઓફિસર ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતુ ફોન નં. ૨૫૩૮૧૮૧૧ EPBX- ૫૪૬, ૪૧૮

નિર્ણય લેવામાં અનુસરવામાં આવતી પદ્ધતિ

ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાના ત્રણ વિભાગો (૧) એસ્ટાબ્લીસમેન્ટ (૨) લેબર-વેલ્કર તથા (૩) ખાતાકીય તપાસ વિભાગમાં નિર્ણય લેવા માટે ફાઈલ નીચેના કમમાં મુકવામાં આવે છે.

(૧) એસ્ટાબ્લીસમેન્ટ -	જુનિ. કલાર્ક	સીની. કલાર્ક	આસી. મેનેજર	લેબર ઓફિસર	ડે. મ્યુનિ. કમિશર (આઈ.આર.)
(૨) લેબર વેલ્કર ઓફિસર (વારસદારની નિમણૂંક કરવી)	લેબર વેલ્કર ઓફિસર	આસી. મેનેજર	લેબર ઓફિસર	ડાયરેક્ટર (એસડબલ્યુએમ)	ઓ.એસ.ડી./ડે.મ્યુનિ.કમિ. (સો.વે.મે.)
(૩) ખાતાકીય તપાસ વિભાગ	ઈન્કવાયરી ઓફિસર	સંકલન અધિકારી	લેબર ઓફિસર	3. મ્યુનિ. કમિ. (વહીવટ/ઓ.એમ.ટી.એસ.) 3. મ્યુનિ. કમિ. (દક્ષિણ પશ્ચિમ ઝોન/શાયર બ્રિગેડ) 3. મ્યુનિ. કમિ. (મધ્યઝોન/સી.એન.સી.ડી.) 3. મ્યુનિ. કમિ. (પૂર્વઝોન/ટેક્ષ) 3. મ્યુનિ. કમિ. (P.ઝોન / SRFDCL) 3.મ્યુનિ.કમિ.(દક્ષિણઝોન/યુ.સી.ડી.) 3.મ્યુનિ.કમિ.(ઉત્તરઝોન/આઈ.આર.) 3.મ્યુનિ.કમિ.(ઉત્તર પશ્ચિમ ઝોન/ હોસ્પિટલ/હેલ્થ) ઓ.એસ.ડી./ ડે. મ્યુનિ. કમિ (સો.વે.મે.)	મ્યુનિ. કમિશર
	આસી. મેનેજર	લેબર ઓફિસર			

મ્યુનિસિપલ કર્મચારીઓ / અધિકારીઓ સામેની પેન્ડિંગ ખાતાકીય તપાસ

(૧-૪-૨૩ ની સ્થિતિ)

નં.	ઈન્કવાયરી ઓફિસરનું નામ	ઇન્કવાયરી ઓફિસરનું નામ દરમ્યાન નિકાલ કરેલ ખાતાકીય તપાસ	હાલ પેન્ડિંગ ખાતાકીય તપાસ	હાલ પેન્ડિંગ ખાતાકીય તપાસ					
				૫ વર્ષથી વધુ	૪ વર્ષથી વધુ	૩ વર્ષ સુધીની	૨ વર્ષ સુધીની	૧ વર્ષ સુધીની	૭ માસ સુધીની
૧	શ્રી રમણસિંહ બી.બારીયા	૨૪	૦૧	-	-	-	૦૧	-	-
૨	શ્રી મુકેશભાઈ જે.શાહ	૧૩	૦૮	-	-	-	-	-	૦૮
૩	શ્રી પ્રવિષ્ણુભાઈ વી. પટેલ	૧૦	૦૨	-	-	-	-	-	૦૨
૪	શ્રી અનિલ એમ.સોની	૧૭	૦૨	-	-	-	-	-	૦૨
૫	શ્રી અદ્રેત એસ. મહેતા	૨૪	૦૭	-	-	-	-	-	૦૭
૬	શ્રી જશવંત કે. પરીખ	૨૦	૦૨	-	-	-	-	-	૦૨

ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાનુ મંજૂર થયેલ બજેટ

(હજારમાં)

ડિપાર્ટમેન્ટ / એકાઉન્ટ કોડ	ખાતુ તથા એકાઉન્ટ હેડનું નામ	૨૦૨૧-૨૦૨૨	૨૦૨૨-૨૩	૨૦૨૩-૨૪
૧૦૭ ૩૦૧૮૮	ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતુ પગાર ખર્ચ	૧૬૩૩૧	૧૫૪૮૪	૧૬૩૦૯
૩૦૩૦૨	ટેલીઝોન બીલ રહેઠાણ	૦૮	૦૦૯	૦૦૯
૩૦૪૦૧	યુનિઝોર્મ	૧૪	૦૧૪	૦૧૪
૩૪૧૦૧	ટેલીઝોન તથા ટ્રેકકોલ (ઓફિસ)	૨૫	૦૨૫	૦૨૫
૩૪૧૦૨	પોસ્ટેજ તથા ટેલીગ્રામ	૧૫	૦૧૫	૦૧૫
૩૪૪૦૧	સ્ટેશનરી	૭૫	૦૭૫	૧૦૦
૩૪૪૦૪	પ્રિન્ટિંગ	૧૦	૦૧૦	૦૧૫
૩૪૪૦૫	ઝરોક્ષ	૧૦૦	૧૦૦	૧૦૦
૩૪૪૦૮	પુસ્તકો, અખબારો અને સામયિકો	૦૮	૦૦૮	૦૦૮
૩૪૮૮૮	અન્ય ખર્ચ	૨૫	૦૨૫	૧૫૦

એપેલેટ અધિકારી તથા જાહેર માહિતી અધિકારીની વિગતો

નં.	નામ	હોદ્દો	ફોન નંબર			ફેક્સ	ઈ-મેઇલ	સરનામું
			ઓફિસ	મોબાઈલ	ઘર			
1.	ડૉ નરેન જી. હજારી	એપેલેટ અધિકારી	૨૫૭૮૯૮૯૯ અક્ષ. ૫૪૬	૮૩૨૭૦૩૮૭૭૩	--	--	narenhajari@ahmedabadcity.gov.in	ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતું, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ૧લો માળ, સરદાર પટેલ ભવન, મધ્યસ્થ કચેરી, દાણાપીઠ, અમદાવાદ
2.	શ્રી અમરીશભાઈ ડી.જાની	જાહેર માહિતી અધિકારી	૨૫૭૮૯૮૯૯ અક્ષ. ૪૧૮	૮૩૨૮૩૮૫૫૬૫	--	--	--	ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતું, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ૧લો માળ, સરદાર પટેલ ભવન, મધ્યસ્થ કચેરી, દાણાપીઠ, અમદાવાદ